

જંગલનાં ઝાડવે ઝાડવે ઘૂમીને
તેનું સત્ય પારખતા ગ્રામજનોને
સમર્પિત.....





* પ્રસ્તાવણા *

કરમદાંનું શાક, ખાટી ભોડીનાં ફૂલનું શરબત, કોઈંબડાંની કાચલી, ચંપાના ફૂલનું શાક, કરમદાની ભાજી, મહુડાંનાં ફૂલના રોટલા અજાણ્યા લાગે છે. આ બધી વાનગીઓનાં નામ? મોટા ભાગે તો લાગશે જ, કારણ કે આ બધી વાનગીઓ હવે વિસ્મૃત થવાની લગોલગ છે. નવા એટલે કે ફાસ્ટ જમાનામાં આપણો આપણી ઘડી બધી વિરાસત ભૂલી ચૂક્યા છીએ. આપણો રોજિંદો, ગ્રામીણ અને આરોગ્યપ્રદ આહાર પણ આ નવા જમાનાની દોટની હડકેટે ચઢી ગયો છે.

ઘરાંગણે ઊગતી અને ક્યારેક જંગલી પણ કહેવાતી અસંખ્ય વનસ્પતિઓમાંથી આપણી બહેનો સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી હતી. સેંકડો વર્ષના પ્રયોગો, કોઠાસૂઝ અને પરંપરામાંથી નિષ્ણન્ન થતા પાકશાસ્ત્રમાંથી કેટલીક વાનગીઓનું સંકલન કરીને આ પુસ્તકમાં સમાવવામાં આવી છે. મોટા ભાગે ગ્રામીણ પ્રદેશોમાંથી સંકલન થયું હોવાને કારણો આ બધી જ વાનગીઓમાં કદાચ શહેરી ચમક, દમક નહીં દેખાય, પરંતુ એ ઉદેશ્ય સાથે જ આ સંપાદન-પ્રકાશન થઈ રહ્યું છે કે શહેરી સમાજ આ વાનગીઓના પરિચયમાં આવે. તેને પ્રમાણિત કરે અને તેનો સ્વાદ પણ માણો.

લગભગ ભુલાઈ ચૂકેલાં કોદરા, બંટી, બાવટો, નાગલી, જેવાં ધાન્યો અને ઝરખલાં, કોઈંબડાં, કરમદાં, ડોડી, મહુડાં જેવી વનસ્પતિમાંથી પણ લિજજત ભરી અને સ્વાસ્થ્ય પ્રદ વાનગી બની શકે છે. ગ્રામજનોના જ્ઞાનને આધારે આપણો જો થોડો પ્રયાસ કરીએ તો વીસરાઈ ચૂકેલી આ વાનગીઓનો ફરીથી આપણા આહારમાં સમાવેશ કરી શકીએ તેમ છીએ. શહેરી રસોડમાં ક્યાંક આવી નાનકડી પણ શરૂઆત થશે તો અમારો આ પ્રયત્ન લેખ લાગ્યો ગણાશે.

હેમા પટેલ
સંપાદક

અનુક્રમણિકા

૧.	કોઈંબડાંનું શાક (Cucumis callosus)	૧
૨.	કોઈંબડાંના કાચવાં (Cucumis callosus)	૧
૩.	કેરડાંનું શાક (Capparis decidua)	૨
૪.	કેરડાંનું અથાણું (Capparis decidua)	૩
૫.	વાંસનું શાક (Bambusa bambos)	૪
૬.	આળુનાં કંદની ભાજ (Meyna laxiflora)	૫
૭.	કરમદાંનાં પાનની ભાજ (Carissa congesta)	૬
૮.	ચંપાનાં ફૂલની ભાજ (Plumeria rubra).....	૭
૯.	કાચરાંની કઢી	૭
૧૦.	મહુડાંનું ચુરમું/ચીકી (Madhuca indica)	૮
૧૧.	મકાઈનાં પાનિયાં (Zea mays).....	૮
૧૨.	ફાંગની ભાજ (Rivea hypocrateriformis)	૮
૧૩.	શણનાં ફૂલની ભાજ (Crotalaria juncea).....	૧૦
૧૪.	ગુંડીનાં પાનની ભાજ (Cordia dichotoma)	૧૦
૧૫.	કાચરી (સૂકી)નું શાક	૧૧
૧૬.	બાવટાનાં ભજિયા (Eleusine coracana)	૧૨
૧૭.	કોદરાની ખીર (Paspalum scrobiculatum)	૧૨
૧૮.	ચાણાની ભાજ (Cicer arietinum)	૧૩
૧૯.	સામાની ખીર (Echinochloa colonum)	૧૪
૨૦.	પાન શીશો (Hibiscus sabdariffa)	૧૪
૨૧.	ગરમાળાની સીંગનું શાક (Cassia fistula)	૨૧
૨૨.	ખાખરાનાં મૂળનું શાક (Butea monosperma)	૨૫
૨૩.	ચણાની ભજાની કઢી (Cicer arietinum)	૨૫
૨૪.	મકાઈના લોટની કઢી (Zea mays)	૨૬

વીસરાતી વાનગીઓ

૨૫.	પુવાડની ભાજ (Cassia obtusifolia)	૧૯
૨૬.	ઉમરાનાં લીલાં ફળનું શાક (Ficus glomerata)	૧૭
૨૭.	મગના પાપડ (Vigna radiata)	૧૮
૨૮.	ફાંગનું શાક (Rivea hypocrateriformis)	૧૮
૨૯.	ચીલની કઢી (Chenopodium album)	૧૯
૩૦.	બાવટાના લોટનું લાડુ (Eleusine coracana)	૨૦
૩૧.	બાવટાના ભજિયા (Eleusine coracana)	૨૧
૩૨.	કાળી ડાંગરના પૂડલા (Oryza sativa)	૨૧
૩૩.	કોદરીની ભસાલેદાર ખીચડી (Paspalum scrobiculatum)	૨૨
૩૪.	કાંગની કોદરીમાંથી શીરો (Setaria italica)	૨૩
૩૫.	કાંદાગોળનું શાક	૨૩
૩૬.	ગોરસ આમલીનાં ફળનું શાક (Mimosa dulcis)	૨૪
૩૭.	ગેગદી(ગેગરી)નું શાક (Xeromphis uliginosa)	૨૪
૩૮.	ગયાં આંબળાંની સુકવણી (Emblica officinalis)	૨૫
૩૯.	ખાટી ભીડીની ફૂલનું શરબત (Hibiscus sabdariffa)	૨૬
૪૦.	બોરકૂટ	૨૬
૪૧.	દૂધની ચોકલેટ	૨૭
૪૨.	શીમળાનાં મૂળનો હલવો (Bombax ceiba)	૨૭
૪૩.	ફાંગનું શાક (Rivea hypocrateriformis)	૨૮
૪૪.	કરમદાનું શાક (Carisa carandas)	૨૮
૪૫.	ગુંડાની ભાજ (Cordia dichotoma)	૨૮
૪૬.	રજકાનું શાક (Medicago sativa)	૨૮
૪૭.	કુરીની ધેંસ (Carvia callosa)	૩૦
૪૮.	કુરીનો શીરો (Carvia callosa)	૩૦
૪૯.	ખાટી આંબળીનાં પાનની ભાજ અથવા શાક (Tamarindus indica)	૩૦
૫૦.	મહૃડાની કઢી (Madhuca indica)	૩૧

૫૧.	ગુવારનાં પાનની ભાજી (Cyamopsis tetragonoloba)	૩૧
૫૨.	અરણીનાં ફૂલની કઢી (Clerodendrum phlomidis)	૩૨
૫૩.	ડોરી વેલાના પાનની ભાજી (Leptadenia persica)	૩૨
૫૪.	ખીજડાની સીંગનું શાક (Prosopis juliflora)	૩૩
૫૫.	સૂરીનાં કંદનું શાક	૩૪
૫૬.	આંબાવિયાનું શાક	૩૪
૫૭.	કળથીનું શાક (Dolichos bifloru)	૩૫
૫૮.	વાસોટીની ભાજી	૩૫
૫૯.	બ્રાહ્મીનું શાક (Centella asiatica).....	૩૬
૬૦.	પીપળના ટેટાનું શાક (Ficus religiosa).....	૩૭
૬૧.	ટિંડોળીના પાનનું શાક (Coccinia grandis)	૩૭
૬૨.	સરગવાના પાનના ભજિયા (Moringa oleifera)	૩૮
૬૩.	કેળાના ફૂલનું શાક (Musa paradisiaca)	૩૮
૬૪.	કોળાના ફૂલની ચટણી (Musa paradisiaca)	૩૮
૬૫.	કાચી કેરીના પાપડ (Mangifera indica)	૩૮
૬૬.	રોટલા	૪૦
૦	મહુડાંના રોટલા (Madhuca indica)	
૦	ઉમરાની છાલના રોટલા (Ficus glomerata)	
૦	કોદરાના રોટલા (Paspalum scrobiculatum)	
૦	સામાના રોટલા (Echinochloa colonum)	
૦	ટીમરૂના છાલના રોટલા (Diospyros melanoxylon)	
૦	બાવટાના રોટલા (Eleusine coracana)	
૦	ભોયરોંગાણીના રોટલા (Solanum xanthocarpum)	
૦	ખાખરાની છાલના રોટલ (Butea monosperma)	
૬૭.	સોયાબીનનો રસોઈમાં ઉપયોગ	૪૪
૬૮.	કાંદાગોળા/હવાઈ કંદ	૪૫

૧. કોઠીબડાંનું શાક

પ્રેષક : નાવીબહેન ખોડાભાઈ આહીર, મુ. નાંદા, પો. સુખપર,
વાયા. આડેસર, તા. રાપર, જિ. કરુણ

જરૂરી સામગ્રી : એક કિલો કોઠીબડાં, એક ચમચી હળદર,
એક ઝીડવું લસણા, ૨ પણી તેલ, ૨૦થી ૨૫ ગ્રામ ગોળ
બનાવવાની રીત : પાકાં કોઠીબડાંની છાલ ઉતારી તેને
ઝીણાં ઝીણાં સમારીને બાંઝી લો. આશરે ૧૦ મિનિટ
સુધી ધીમા તાપે ઉકાળ્યા બાદ તેનું પાણી કાઢીને તેને
કોરાં કરો. ત્યાર બાદ તેલમાં વાટેલું લસણા નાખી
બાંદેલાં કોઠીબડાં નાખો. ઉપર મરચું, હળદર, ધાણાજીસુ,
મીઠું અને ગોળ નાખી હલાવીને થોડી વાર ચડવા દો.
મસાલો કોઠીબડાંમાં ચડી જાય એટલે ગરમાગરમ
પીરસો. કોઠીબડાંનું શાક સ્વાદમાં ખટાશ વાળું
લાગે છે.

૨. કોઠીબડાંનાં કાચલાં

પ્રેષક : નાવીબહેન ખોડાભાઈ આહીર, મુ. નાંદા,
પો. સુખપર, વાયા. આડેસર, તા. રાપર, જિ. કરુણ

જરૂરી સામગ્રી : કોઠીબડાં

બનાવવાની રીત : પાકાં અને કઠણ કોઠીબડાંની ઝીણી
ઝીણી કાતરીઓ પાડીને સૂકવી નાખો. ખાટલા ઉપર કપડું
નાખીને ૪થી૫ દિવસ સૂકવવા મૂકો. સંપૂર્ણ સુકાઈ ગયા બાદ
હવા ચુસ્ત ડબામાં ભરી લો. મહેમાન આવે ત્યારે વિશેષ વાનગી
તરીકે તેલમાં તળીને આપો. ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તેલમાં કડક
ભુલાઈ ગયેલા સ્વાદ ઉપર ભાવિ પેણીનો અધિકાર

થાય તે રીતે તળવું. તળીને કોઈંબડા ઉપર મીહું અને મરચું ભભરાવવાથી ખાટા-મીઠા લાગે છે.

વનસ્પતિની માહિતી : કોઈંબડાના વેલા થાય છે. તેનાં પીળાં ફૂલ અને કાકડીના વેલા જેવો વેલો અને પાન થાય છે. તેનાં ફળ ગોળ, લંબગોળ અને ઉપર ચદ્વાપદ્વા હોય છે. ફળનું કંદ સામાન્ય રીતે નાની કેરી જેવડું હોય છે, જેને નીદામણ તરીકે લોકો ક્યારેક ઉખેડીને નાખી દેતા હોય છે. આ વનસ્પતિની પ્રાપ્તિ ખેતર, શેઢા-પાળા, ગૌચર કે અન્ય સ્થાનેથી થાય છે. ચોમાસામાં ભાદરવો અને આસો મહિનામાં આ ફળ પ્રાપ્ત થાય છે.

સ્વાસ્થ્ય ઉપર અસરઃ જઠર સાફ કરે છે. પાચનતંત્રના રોગ મટે છે.

3. કેરડાનું શાક

પ્રેષક : નીનાબહેન છનાભાઈ પારળી મુ. નાંદા,
પો. સુખપર, વાયા. આડેસર, જિ. કચ્છ

જરૂરી સામગ્રી : કેરડાં, રાઈ, મેથી, લસણા (સૂકું), મીહું,
હળદર, મરચું, તેલ રૂચિ મુજબ

બનાવવાની રીત : કેરડાનાં ફળ કાચાં ફૂલાં (બીજ વગરનાં) વીણી લાવીને તેને પાણીમાં ધોઈને ફળને સામાન્ય ચીરા કરવા(આખા ફળ રાખો તો પણ ચાલે) રાઈ, મેથી, લસણા (સૂકું), મીહું, હળદર, મરચું, તેલ વગેરેમાં વધાર કરવામાં આવે છે. આ કેરડાનું શાક કોરું બનાવવામાં આવે છે. પાણીવાળા શાકમાં સ્વાદ બરાબર આવતો નથી. ઉત્તરદાતા બહેનશ્રીના જણાવ્યા મુજબ આશારે ૧૦થી ૧૨ પરિવારો કેરડાનાં કેરાનાં શાક ખાય છે.

અન્ન એવો ઓડકાર

વનસ્પતિની માહિતી : શરૂઆતમાં કાચા લીલા રંગના ફળ પાકે ત્યારે લાલ થાય છે. આ વનસ્પતિ ફાગણા, ચૈત્ર માસમાં અને ઉનાળાની ઋતુમાં ફળ આપે છે. દિનપ્રતિદિન આ વનસ્પતિ વિકાસ પામતી જાય છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : કેરડાનાં કેરાનાંનું શાક ખાવાથી શરીરનું કળતર મટી જાય છે. વા મટી જાય છે. સાંધાનો વા પણ મટી જાય છે.

■ ૪. કેરાનાંનું અથાણું

પ્રેષક : નીનાબહેન છનાભાઈ પારગી મુ. નાંદા, પો. સુખપર, વાયા. આડેસર, જિ. કસ્યુ

જરૂરી સામગ્રી : બે કિલો કેરડાં, ૧૫૦થી ૨૫૦ ગ્રામ તેલ, ૧૦ થી ૧૫ ગ્રામ લવિંગ, ૨૫ ગ્રામ તજ, સૂકું દળેલું તીખું ભરચું ઊર ગ્રામ, ૧૫થી ૨૦ ગ્રામ હળદર, ધાળાજીરુ, ગરમ મસાલો, ૧૦થી ૧૫ ગ્રામ મેથી, સ્વાદ પ્રમાણો મીઠું.

બનાવવાની રીત : કેરડાનાં કૂણાં કાચાં કેરાં વીણી લાવી તેને કોઈક વાસણમાં ભરી તેમાં કેરડાં દૂબી જાય ત્યાં સુધી પાણી ભરવું અને તેમાં મીઠું નાખવું. આ મીઠાનું પ્રમાણ ૧ કિલોગ્રામ કેરડામાં આશરે ૧૦૦ ગ્રામ જેટલું રાખવું અને ૭ દિવસ સુધી ખુલ્લા તાપમાં તે વાસણ ઢાંકીને મૂકી રાખવામાં આવે છે. સાતમા દિવસે તે પાણી કાઢી લઈને તે કેરડાને ચોખ્ખા પાણીમાં ત્રણ વખત ધોઈને સૂકીવી દેવામાં આવે છે. સંપૂર્ણ સુકાઈ ગયા બાદ તેનું અથાણું નાખવામાં આવે છે. તેલ, મેથી, તજ, લવિંગ, દળેલું ભરચું, હળદર, સામાન્ય મીઠું

(જરૂર જણાય તો ૪) નાસ્કૃત્તાઈ ગયેલા સ્વાદ ઉપર ભાવિ પેઢીનો અધિકાર

બરાબર તેલમાં કકડાવીને કેરડાને ઠરવા દેવામાં આવે છે. ત્યાર બાદ કાચની બરણી અથવા માટલીમાં ભરવામાં આવે છે.

૫. વાંશનું શાક

પ્રોષ્ઠક : શાંતાબહેન બંડુભાઈ ગોવિંદભાઈ પાડવી મુ. પાયરપાડા, પો. ગલંડુંડ, તા. આહવા, જિ. ડાંગ.

જરૂરી સામગ્રી : ઉ પળી તેલ, બે ચમચી મરચું, એક ચમચી હળદર, એક ચપટી ધાણાજીરુ, રાઈ

બનાવવાની રીત : વાંસ બે પ્રકારના જોવા મળે છે. તે બન્ને પ્રકારના વાંસનું શાક બનાવી શકાય, જેમાં માનેલ નામના વાંસની જાતનું શાક સ્વાદમાં વધુ પ્રયત્નિત છે.

માનેલની ફૂણી ઝૂપળો (પીલાં) જમીનમાંથી બહાર નીકળે છે. જે બહાર નીકળે તે આશરે ચાર આગળથી એક મૂઠ સુધીનાં ફૂણાં પીલાં તોડી લેવા. ત્યાર બાદ તેની ઉપરની કઠણ છાલ ચઘ્યુ વડે ઉતારી લેવી. ત્યાર બાદ જીણી જીણી ઊભી ચીરીઓ કરી બાંઝી નાખવા. તેને બાંઝી નાખ્યા બાદ પાણી કાઢી શાકની જેમ ટુકડા કરવા. આ ટુકડાને તેલ, મરચું, મીઠું, હળદર અને મસાલા નાખીને વધાર કરવો. ગુણોથી ભરપૂર આ શાક ખૂબ જ પૌણ્ટિક છે.

વનસ્પતિની માહિતી : આ વનસ્પતિ જંગલ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં જૂલાઈ-ઓગસ્ટ મહિનાના સમય દરમ્યાન જોવા મળે છે. તેનું સંવર્ધન પીલાં અને બીજ દ્વારા થાય છે.

વાંસ વિશે પ્રાથમિક માહિતી: ગુજરાતના ડાંગના જંગલમાં બે પ્રકારના વાંસ થાય છે. (૧) કાસડ, (૨) માનેલ.

અન્ન એવો ઓડકાર

વીસરાતી વાનગીઓ

(૧) કંસડ : કંસડ એ સ્થાનિક પ્રચલિત જાત છે. તેને વહેલી કુપળો ફૂટે છે તથા માત્ર એક વખત બીજ આવે છે અને કંસડનું શાક ખાવાથી કળતરમાં વધારો થાય છે.

(૨) માનેલ : માનેલ પણ સ્થાનિક નામ છે, જેની કુપળો મોડી ફૂટે છે અને વારંવાર બીજ આવે છે તથા તેનું શાક કે અથાણું ખાવાથી શરીરની કળતર, સાંધાનો દુઃખાવો દૂર થાય છે. તેનાં બીજના રોટલા ખવાય છે.

વાંસ વિશે માન્યતા : વાંસનાં બીજ વિશેષ મહેનતના અંતે એકઠાં કરવામાં આવે છે અને તેનાં બીજને દળીને તેનો રોટલો બનાવી ખાવાથી માણસનું આયુષ્ય વધે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : સાંધાનો દુઃખાવો, કળતર દૂર થાય છે.

૭. આળુનાં કંદની ભાજી

પ્રેષક : સીતાબહેન સોનિયાભાઈ ગાંધિત મુ. પાયરપાડા, પો. ગલફુંડ, તા. આહવા, જિ. ડાંગ

જરૂરી સામગ્રી : આળુ કંદ, પાણી, તેલ, રાઈ, જરૂ, મરચું, મીઠું, હળદર, ધાણાજરૂ, ગરમ મસાલો રૂચિ મુજબ.

બનાવવાની રીત : આળુનાં કંદને કાઢી લાવી પાણીમાં બરાબર ધોઈને બાફવા. કંદને બાફ્યા વિના બનાવવાથી જીબ ઉપર ખંજવાળ આવે છે. આ ખંજવાળ થોડી જ વાર માટે આવે છે. જે ચિંતાજનક નથી. તેની છાલ ઉતારીને બટકાની જેમ નાના ભુલાઈ ગયેલા સ્વાદ ઉપર ભાવિ પેઢીનો અધિકાર

ટુકડા કરી કડાઈમાં તેલ મુકી રાઈ, જરૂરો વધાર કરી તેનું શાક બનાવો. સૂકી ભાજી તથા રસાદાર બન્ને શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

વનસ્પતિની માહિતી : આળુ કંદના છોડ થાય છે. સ્થાનિક વિસ્તારમાં તમામ લોકાના ઘરે આ કંદ જોવા મળે છે. તેના છોડની નીચે બટાટાંની જેમ આળુ નીકળે છે. વિશેષ ચોમાસુ ઋતુ અનુકૂળ આવે છે. સામાન્ય રીતે સંવર્ધન કંદથી જ થાય છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : આ કંદનું શાક ખાવાથી પેટ સાફ થાય છે તથા જાડા મટાડે છે.

૭. કરમદાંની ભાજી(કરમદાંનાં પાનની ભાજી)

પ્રેષક : છાયાબહેન રામાભાઈ ઠાકરે મુ. વકર્યા,
પો. ગલંડા, તા. આહવા, જિ. ડાંગ

જરૂરી સામગ્રી : ૫૦૦ ગ્રામ કરમદાંનાં પાન અને
કૂપળો, તુ ચમચી મરચું, તુ પળી તેલ, ૧ ફિલ્ડવું લસણા,
અડધો ગલાસ પાણી, ધાણાજરુ, મીઠું સ્વાદ મુજબ

બનાવવાની રીત : કરમદાંની કૂણી કૂણી કૂપળો અને કૂણાં
પાન લાવી જીણા જીણા ટુકડા કરીને મરચું, મસાલા અને
તેલ તથા લસણા નાખી તેનો વધાર કરો. વધાર કરી
તેમાં સામાન્ય પાણી નાખો. આ ભાજી સ્વાદમાં ખટમીઠી
લાગે છે.

વનસ્પતિની માહિતી : કરમદાં જંગલી જાત છે, જે જંગલમાં
વિશેષ જોવા મળે છે. કરમદાંનાં પાન કંથેર કે લીંબુ જેવી અને
કાંટાળી વનસ્પતિ છે. તેનાં પાકાં ફળ ખવાય છે. બારેમાસ જોવા મળે
અન્ન એવો ઓડકાર

૪. સંવર્ધન કલમ, બીજ, ગાંઠથી થાય છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : શરીરની ગરમી ઘટાડે છે. સ્ત્રીના ગર્ભાશયના રોગ (ગરમી) મટાડે છે.

૮. ચંપાનાં ફૂલની ભાજી

પ્રેષક : છાયાબહેન રામાભાઈ ઠાકરે મુ. વકાર્ય,
પો. ગલંડુંડ, તા. આહવા, જિ. ડાંગ

જરૂરી સામગ્રી : ૫૦૦ ગ્રામ ચંપાનાં ફૂલ, ૩ ચ્યમચી ધાણાજીરુ, આશરે ૩૦ ગ્રામ મરચું, ૧ ચ્યમચી હળદર, ૧ ફીડવું લસણા, સ્વાદ મુજબ મીઠું

બનાવવાની રીત : ચંપાનાં આખાં ફૂલ લાવી તેને આખાં ને આખાં અડધી વાટકી પાણીમાં ૫ મિનિટ બાઝી લો. તેમાં મરચું, મસાલા, તેલ વગેરે ઉમેરી વધાર કરો. બાઝી લીધા બાદ કોરાં કરીને ૪ વધાર કરો. વધાર કરતી વખતે પાણી ઉમેરવું નહીં. વધાર કરીને તરત ૪ ઉતારી લો, જેથી ભાજ્ઞાનો ટેસ્ટ ન બદલાય.

વનસ્પતિની ભાણિતી : આ વનસ્પતિ બગીચા કે ઘરઆંગણે થાય છે. તેનું સંવર્ધન કલમ દ્વારા થાય છે.

૯. કાચરાંની કટી

પ્રેષક : મહેશભાઈ બાબુભાઈ પટેલિયા સરજુમી, પટેલ ફળિયું

જરૂરી સામગ્રી : કાચરાં, ચણાનો લોટ (બેસન), તેલ, મરીમસાલા

બનાવવાની રીત : સૂકાં કાચરાંને ખાંડી (દળી)ને તેનો પાઉડર તૈયાર ભુલાઈ ગયેલા સ્વાદ ઉપર ભાવિ પેઢીનો અધિકાર

કરી, ચણાનો લોટ (૧ કિલોગ્રામ પાઉડરમાં ૨૫૦-૩૦૦ ગ્રામ ચણાનો લોટ ઉમેરી) તેમાં તેલ, મરીમસાલા નાખો. આશરે ૧ લિટર પાણી નાખી મિશ્રણમાં મસાલા નાખી વધાર કરી કઢી બનાવો.

વનસ્પતિની માહિતી : કાચરું મકાઈમાં થતો વેલાવાળો મિશ્ર પાક છે. તેનાં ફળ કાચરાં તરીકે ઓળખાય છે. આ વનસ્પતિ ચોમાસામાં થાય છે. કાચરી ખાટી હોય છે તેથી તેની કઢી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કઢીમાં દહીં કે છાશની બિલકુલ જરૂર પડતી નથી.

સ્વાસ્થ્ય ઉપર અસર : કાચરી એ હલકો ખોરાક છે. પચવામાં સરળ છે. તેમાથી વિટામિન સી મળે છે.

૧૦. મહુડાંનું ચુરમુ/ચીક્કી

પ્રેષક : દિનેશભાઈ સબૂરભાઈ હઠીલા

મુ. સરજુમી, તા. લીમખેડા, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : બે વાટકી મહુડાં, ૧ વાટકી સીંગ અથવા ચણા

બનાવવાની રીત : મહુડાંનાં ફૂલને સમારવામાં આવે છે.

ત્યાર બાદ તેને માટીની તાવડીમાં શેકો. શેકી લીધા પછી બહાર કાઢી ઠંડાં પડવા દો. ત્યાર બાદ તેને સીંગદાળા કે

ચણા નાખીને ખાંડણીમાં ખાંડી લો. જેમ-જેમ ખાંડતા જશો તેમ બધુ નરમ થઈને ચુરમુ તૈયાર થઈ જશે. જેને

માટીના વાસણામાં ભરી રાખો. આ વાનગી ઘણા દિવસો સુધી સારી રહે છે અને સ્વાદમાં એકદમ અદ્ભૂત રહે છે.

વનસ્પતિની માહિતી : મહુડાંનું મોટું વૃક્ષ થાય છે. મહુડાંનાં ફૂલ

સફેદ હોય છે, તેનાં પાન મોટાં હોય છે. મહુડાંનું વૃક્ષ રપથી ત૦ ફૂટ ઊંચું થાય છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : પ્રસૂતાને આપવાથી શક્તિ મળે છે.

શક્તિવર્ધક છે. શરીરનું કળતર અને સાંધાનો દુઃખાવો મટે છે.

૧૧. મકાઈનાં પાનિયાં

પ્રેષક : કૈલાસબહેન ગુલાબભાઈ પટેલિયા (ઘાટા ફળિયું), સરલાબહેન બાબુભાઈ પટેલિયા (તળાવ ફળિયું) મુ. સરજુમી, તા. લીમખેડા, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : મકાઈ, ખાખરાનાં પાન, મીહું સ્વાદ મુજબ બનાવવાની રીત : મકાઈનો લોટ ચોળીને તેને હુંફાળા પાણીથી સામાન્ય કણોક બાંધો જેમાંથી ભાખરીના લુઆ જેવાં લુઆ બનાવી પછી ખાખરાના બે પાન વચ્ચે મુકી દબાવી દો. ત્યારબાદ છાણાં ઉપર પાન બન્ને બાજુથી બળી જાય ત્યાં સુધી સેકી લો. આ પાનીયા અડદની દાળ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે વડના પાન અને આંકડાના પાન મુકીને પણ પાનીયાં બનાવી શકાય.

વનસ્પતિની માહિતી : મકાઈ

સ્વાસ્થ્ય ઉપર અસર : મકાઈ પચવામાં સરળ છે.

૧૨. ફુંગાની ભાજી

પ્રેષક : કૈલાસબહેન ગુલાબભાઈ પટેલિયા (ઘાટા ફળિયું) મુ. સરજુમી, તા. લીમખેડા, જિ. દાહોદ

ભુલાઈ ગયેલા સ્વાદ ઉપર ભાવિ પેઢીનો અધિકાર

જરૂરી સામગ્રી : ફાંગની ભાજી, તેલ વધારવા માટે, મીઠું, મરચું

બનાવવાની રીત : ફાંગના પાન લાવી જીણાં કાપી નાખી બાફી લો અને પછી વધારીને તેમાં મીઠું, મરચું નાખી ઉતારી લો.

વનસ્પતિની માહિતી : ફાંગ નદી-નાળાં, શેડો-પાળા ઉપર થતો વેલો છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : પેટ સાફ થાય છે.

૧૩. શાણનાં ફૂલની ભાજી

પ્રેષક : સરલાબહેન બાબુભાઈ પટેલિયા (તળાવ ફળિયું),

જગદીશભાઈ રાયસિંગભાઈ ભૂરિયા (જાલિયાપાડા)

મુ. સરજુમી, તા. લીમખેડા, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : શાણનાં ફૂલ, મીઠું, મરચું, તેલ, લસણ

બનાવવાની રીત : શાણનાં ફૂલ વીણી લાવી સાફ કરી તેલમાં વધારી તેમાં લસણ, મીઠું, મરચું નાખી બરાબર ચડવા દેવું. ચડી જાય એટલે ગરમ ગરમ રોટલા સાથે પીરસો.

વનસ્પતિની માહિતી : આ વનસ્પતિનાં ફૂલ પીળાં હોય

છ અને ઘૂઘરા (સીંગ) બેસે છે. તેના રેસા કાઢી દોરી કે દોરદું બનાવવામાં આવે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : શાણની ભાજી ખાવાથી પેટનો ગેસ

દૂર થાય છે. પચવામાં હલકો ખોરાક છે.

૧૪. ગુંદીનાં પાનની ભાજી

પ્રેષક : સરલાબહેન બાબુભાઈ પટેલિયા (તળાવ ફળિયું)

અન્ન એવો ઓડકાર

મુ. સરજૂમી, તા. લીમખેડા, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : ૫૦૦ ગ્રામ ગુંદીની કોમળ કુંપળનાં પાન,
તેલ, મીઠું, મરચું, હળદર, ધાણાજીલુ, ગરમ મસાલો

બનાવવાની રીત : ગુંદીનાં પાન જીણા કાપી લો. કડાઈમાં
તેલ મુકી ગુંદીના પાન, મરચું, મીઠું, હળદર, ધાણાજીલુ
નાખી ચડવા દો. બરાબર ચડી ગયા પછી ઉતારી લો.

વનસ્પતિની માહિતી : ગુંદીનું ઝાડ મોટું છે, જે જંગલ કે
શેરા-પાળા ઉપર જોવા મળે છે. ગુંદીનાં પાન લંબગોળ
હોય છે. અખાઢ માસે તેનાં ફૂલ બેસે છે, જે જૂમખાંમાં
હોય છે. ગોળ ગોળ નાનાં નાનાં ફળો બેસે છે, જે
પાકે ત્યારે ખાવામાં ઉપયોગી છે. તે મીઠાં સ્વાદિષ્ટ
ચીકણાં હોય છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : ઉનાળાના સમયે લીલી ભાજનું
શાક ખાવા મળે છે.

૧૫. કાચરી સૂકીનું શાક

પ્રેષક : સરલાબહેન બાબુભાઈ પટેલિયા (તળાવ ફળિયું)

જરૂરી સામગ્રી : બે વાટકી સૂકવેલી કાચરી, તેલ, મરચું,
હળદર, ધાણાજીલુ

બનાવવાની રીત : સૂકી કાચરીને ગરમ પાણીમાં બાફી લો.

બફાઈ જાય એટલે કડાઈમાં તેલ મુકી રાઈ, જીલો વધાર
કરો. ત્યારબાદ બાફેલી કાચરી, મરચું, હળદર, ધાણાજીલુ,

ગરમ મસાલો નાખી થોડીવાર ધીમા તાપે ચડવા દો. પાંચ
મિનીટમાં ખાદું મીઠું સ્વાદિષ્ટ શાક તૈયાર. (સૂકવેલી કાચરીમાં
પહેલેથી મીઠું નાખેલ હોય તેથી શાકમાં મીઠું ન નાખવું.)

વનસ્પતિની માહિતી : કાચરી કુદરતી રીતે ખેતરોમાં ઉગે છે. લાંબા વેલા તૈયાર થઈ દોડેક માસમાં પીળાં ફૂલ આવી કાચરી (ફળ) બેસે છે. કાચાં હોય ત્યારે કડવાં અને પાકે ત્યારે ખાટાંભીઠાં લાગે છે. આ પાક ચોમાસુ અને શિયાળુ એમ બે મોસમમાં જોવા મળે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : ખટાશયુક્ત શાક ખાવામાં ઉપયોગી છે. પશુને આફરો ચઢે ત્યારે દવા તરીકે ઉપયોગી છે.

૧૭. બાવટાનાં ભાજિયાં

પ્રેષક : સરલાબહેન બાબુભાઈ પટેલિયા (તળાવ ફળિયું)

મુ. સરજુમી, તા. લીમખેડા, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : ૫૦૦ ગ્રામ બાવટાનો લોટ, હળદર, ગરમ મસાલો, ૧૦૦ ગ્રામ કોથમીર, તેલ, મીઠું, મરચું

બનાવવાની રીત : બાવટાના અનાજનો જીણો લોટ તૈયાર કરો. આ લોટમાં હળદર, મરચું, ગરમ મસાલો, મીઠું, જીણી સમારેલ કોથમીર અને એક પળી તેલ નાખી ખીરુ તૈયાર કરો. આ ખીરામાંથી ગરમા ગરમ ભજ્યા ઉતારી લો.

વનસ્પતિની માહિતી : બાવટો હલકા વર્ગનો ધાન્ય પાક છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : પૌષ્ટિક ખોરાક છે, પચવામાં હલકો છે.

૧૮. કોદાનાની ખીર

પ્રેષક : હંસાબહેન બચુભાઈ હઠીલા (પટેલ ફળિયું)

અન્ન એવો ઓડકાર

જરૂરી સામગ્રી : ૧૦૦ ગ્રામ કોદરા, ૧ લિટર દૂધ, ૨૦૦ ગ્રામ ખાંડ, પાંચ નંગ એલચી, દસ નંગ બદામનો ભૂકો

બનાવવાની રીત : કોદરાને ખાંડણીથી ખાંડી અધકયરા કરી લેવા તેને દૂધમાં ચડવા દો. કોદરી બરોબર ચડી જાય એટલે ખાંડ, એલચી અને બદામ નાખો.

વનસ્પતિની માહિતી : કોદરા એક હલકા વર્ગનો ધાન્ય પાક છે. ચોમાસામાં તેનું વાવેતર કરવામાં આવે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : પચવામાં હલકો ખોરાક છે, અશક્ત, વૃદ્ધ કે બાળકો માટે પૌષ્ટિક ખોરાક છે, શક્તિવર્ધક પોષક તત્ત્વો મળી રહે છે, પ્રસૂતિ સમયે મહિલાઓને શક્તિ વધારે છે. બળકોને પચવામાં હલકો ખોરાક ગણાય છે.

૧૮. ચણાની ભાજી

પ્રેષક : મજુંલાબહેન શીનાભાઈ હઠીલા, મંજુલાબહેન મથુરભાઈ મછાર (મછારફ), મુ. સરજુમી, તા. લીમખેડા, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : ચણાની ભાજી, મીઠું, મરચું, તેલ

બનાવવાની રીત : ખેતરમાંથી ઝૂણી ભાજી વીણી લાવી કાપીને વધારીને અંદર મીઠું, મરચું નાખી બરાબર ચઢી જાય પછી ઉતારી લો. ચણાની લીલી ભાજને વાટી-લસોટીને પણ બનાવી શકાય.

વનસ્પતિની માહિતી : ચણા કઠોળ વર્ગનો પાક છે, લીલી ચણાની ભાજી બને છે, ખાવામાં સ્વાદિષ્ટ છે. શક્તિવર્ધક છે. પેટનાં નાનાંમોટાં દર્દ મટે છે.

૧૯. સામાની ખીર

પ્રેષક : રેખાબહેન ગજાભાઈ હઠીલા (પટેલ ફળિયું) મુ. સરજુમી,
તા. લીમખેડા, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : ૧૦૦ ગ્રામ સામો, ૨૦૦ ગ્રામ ખાંડ,
૧ લિટર દૂધ, પાંચ નંગ એલચી, ૧૦ નંગ બદામ

બનાવવાની રીત : સામાને દૂધમાં ચડવા દો. સામો બરોબર
ચડી જાય એટલે ખાંડ, એલચી અને બદામ નાખો.

વનસ્પતિની માહિતી : ડાંગર તથા મકાઈના પાકમાં
ચોમાસાની ઝતુમાં નીંદણ તરીકે સામો થાય છે. તેના
દાણા બિલકુલ જીણા હોય છે. દુષ્કાળના વર્ષમાં બીજું
ધાન ન મળે ત્યારે તેના રોટલા ખાઈ શકાય છે.

૨૦. પાન થીથો

પ્રેષક : શકુન્તલાબહેન ચીમનભાઈ હઠીલા મુ. સરજુમી,
તા. લીમખેડા, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : ભીડાના પાન, મકાઈની થૂલી (ભરડેલી
મકાઈ), પાણી,

બનાવવાની રીત : ભીડાનાં પાન ખેતરમાંથી લાવી બાફી
નાખો. વધેલું પાણી કાઢી નાખી અંદર પાણીમાં મકાઈની
થૂલી નાખી બરાબર તૈયાર થઈ ગયા પછી ઉતારી લો.

૨૧. ગાયમાળાની કીંગન્ઝ શાક

પ્રેષક : જગદીશભાઈ રાયસિંગભાઈ ભૂરિયા મુ. જાલિયાપાડા,
તા. આહવા, જિ. ડાંગ

જરૂરી સામગ્રી : ગરમાળાની લીલી કુમળી સીંગ, મીઠું, મરચું, તેલ

બનાવવાની રીત : ગરમાળાની નાની નાની સીંગો લાવી જીણી સમારી બાફી નાખો. તેમાં મીઠું, મરચું, હળદર અને એક ટામેઠું નાખી વધારી દો. આ શાક સ્વાદમાં તુરુ અને મીઠાશવાળું લાગે છે.

વનસ્પતિની માહિતી : ગરમાળાનું વૃક્ષ થાય છે. પીળા રંગનાં ફૂલ થાય છે અને સીંગ એકથી દોઢ ફૂટ લાંબી હોય છે. પાકે ત્યારે તેનો રંગ કાળો થાય છે
સ્વાસ્થ્ય ઉપર અસર : કબજિયાત દૂર કરે છે.

૨૨. ખાણણાની બૂટનું શાડ

પ્રેષક : કમળાબહેન દલાભાઈ નિનામા (વાવડી ફળિયું)

જરૂરી સામગ્રી : ખાખરાનાં મૂળ ૫૦૦ ગ્રામ, મીઠું, મરચું, હળદર, તેલ, ધાણાજીરુ

બનાવવાની રીત : નાની ખાખરીનાં કૂણાં મૂળ કાઢી જીણાં કાપી નાખી સીધા તેલમાં વધારીને તેમાં અંદર મીઠું, મરચું, હળદર, ધાણાજીરુ, નાખી બરાબર ચડવા દેવું. ચડી જાય એટલે ગરમા ગરમ રોટલા સાથે પીરસો.

વનસ્પતિની માહિતી : ખાખરાનું ઝાડ થાય છે. તેનાં ફૂલ કેસરી રંગનાં હોય છે, જે ફેબ્રૂઆરી-માર્ચમાં જોવા મળે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : શરીરમાં ઠંડક રહે છે.

૨૩. ચણાની ભાજીની કઢી

પ્રેષક : જસીબહેન રામસિંગભાઈ ડાંડોર

ભુલાઈ ગયેલા સ્વાદ ઉપર ભાવિ પેઢીનો અધિકાર

જરૂરી સામગ્રી : ચણાની ભાજી, મીઠું, મરચું, હળદર, તેલ, દહી અથવા છાશ, મકાઈનો લોટ
બનાવવાની રીત : ચણાના છોડની ટોચ ઉપરની કુંપળો તોડી લાવી બરાબર પાણીમાં ધોઈને કાપી નાખો. ત્યાર બાદ તેલમાં વધારી અંદર મીઠું મરચું, હળદર નાખી મકાઈનો લોટ નાખો. છેલ્લે દહી અથવા છાશ નાખી બરાબર ઉકાળીને ઉતારી લો.
(નોંધ: ઉપરોક્ત પદ્ધતિ મુજબ છાશ અથવા દહી નાખ્યા વિના ચણાની ભાજની મોળી કઢી બનાવી શકાય છે.)
સ્વાસ્થ્ય ઉપર અસર : પેટ સાફ કરે છે.

૨૪. મકાઈના લોટની કથી

પ્રેષક : જસીબહેન રામસિંગભાઈ ડિંડોર મુ. સરજુમી,
તા. લીમખેડા, જિ. દાહોદ
જરૂરી સામગ્રી : મકાઈનો લોટ, પાણી, મીઠું, મરચું,
હળદર, તેલ, દહી અથવા છાશ
બનાવવાની રીત : મકાઈના લોટને છાશમાં નાખી બરાબર
મિશ્ર કરો. ત્યાર બાદ તેલમાં રાઈ, જીરુ, મેથી, મીઠો
લીમડો, લસણ વગેરે નાખી આ મિશ્રણ સાથે વધાર
કરો અને જરૂર મુજબ મીઠું, મરચું, હળદર નાખો.
સ્વાસ્થ્ય ઉપર અસર : પચવામાં હલકો ખોરાક હોવાથી
પાચનશક્તિ વધે છે. ખાવામાં સ્વાદિષ્ટ છે.

૨૫. પુવાડની ભાજી

પ્રેષક : શકુબહેન રવજીભાઈ હઠીલા (વાવડી ફળિયું)

મુ. સરજૂમી, તા. દાહોદ

જરૂરી સામગ્રી : પુવાડ(કુવાડિયા)નાં કુણાં પાન, મીઠું, મરચું, હળદર, તેલ, ધાણાજ્રુ, રાઈ, જરૂ

બનાવવાની રીત : પુવાડની કુણી કુણળનાં પાન લાવી બરાબર ધોઈને સમારી નાખો. ત્યાર બાદ તેને થોડા પાણીમાં બાઝી પાનને નિચોવી નાખો. કડાઈમાં તેલ મૂકી રાઈ, જરાથી વધાર કરો. સ્વાદ મુજબ મીઠું, મરચું, હળદર, મરીમસાલા નાખી તૈયાર થઈ ગયા પછી ઉતારી લો. બાઝીને પાન નીચોવતા વધેલા પાણીથી રસાદાર શાક બનાવો.

વનસ્પતિની માહિતી : પુવાડ નદી-નાળાં, શેઢા-પાળા ઉપર થતો છોડ છે. તેની સોંગો આવે છે. ખાસ ચોમાસામાં જોવા મળે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : પેટમાંથી કરમીયા દૂર થાય છે.

૨૭. ઊમરાનાં લીલાં ફળનું શાક

પ્રેષક : હંસાબહેન મોહનભાઈ બારિયા

જરૂરી સામગ્રી : ઊમરાનાં કાચાં ફળ, મીઠું, મરચું, હળદર, તેલ

બનાવવાની રીત : ઊમરાનાં લીલાં ફળને ધોઈને એક તપેલામાં બાઝી લો. પાણી નિતારીને સામાન્ય શાકની માફક તેલમાં વધાર કરી મરીમસાલા નાખી શાકને ૧૦-૧૫ મિનિટમાં તાપેથી ઉતારી લો.

વનસ્પતિની માહિતી : ઊમરાના ઝડનાં ફળ ગોળ હોય છે. પાકે ત્યારે ભુરા રંગના થાય છે ભુલાઈ ગયેલા સ્વાદ ઉપર ભાવિ પેણીનો અધિકાર

સ્વાસ્થ્ય ઉપર અસર : સંપૂર્ણ પૌષ્ટિક શાક છે, કુદરતી પોષક તત્ત્વો પ્રાપ્ત થાય છે.

૨૭. મગના પાપસ

પ્રેષક : મંજુલાબહેન મગનભાઈ ધનજ્યભાઈ લુહાર મું.

પિછાણા (બાદલપુર), તા. રાપર, જિ. કચ્છ

જરૂરી સામગ્રી : ૧ કિલો મગનો લોટ, ૨૦ ગ્રામ કાળાં મરી, ૧થી ૨ ચમચી ખારો

બનાવવાની રીત : મગને ૧૦ કલાક પાણીમાં પલાળીને સૂકવી નાખો. સૂકવ્યા પછી તેને દળીને લોટ બનાવો. આ લોટને કઠણ રાખવો, તે પછી ખાંડણી કે ખલમાં ખાંડો. ખાંડયા પછી કોરો થાય ત્યારે રોટલીની જેમ તેલ ચોપડીને પાપડ વણા અને વણીને સૂકવી નાખવા. મગના પાપડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

૨૮. ફાંગાનું શાક

પ્રેષક : મોધીબહેન હોથીભાઈ ગણેશભાઈ પટેલ

જરૂરી સામગ્રી : ૧ કિલો ફાંગાનાં પાન, ૨ ચમચી મરચું, એક ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, બે પળી તેલ.

બનાવવાની રીત : ફાંગાનાં લીલાં પાન ધોઈને સાફ કરો. તેના ટુકડા કરીને પાણીમાં બાફો. પાણીમાં બાફતી વખતે પાણી જરૂર મુજબ જ લેવું. નહીં તો સત્વો પાણીમાં જતા રહેશે. ત્યાર બાદ પાણી નિતારી તેમાં મરચું, મીઠું, હળદર, ગરમ મસાલો નાખી

અન્ન એવો ઓડકાર

તેલમાં વધારો.

(નોંધ - વધારમાં પાણી નાખવું નહીં, કોરો વધાર કરવો. ૧૦ મિનિટ કરતાં વધારે બાફવું નહીં, વધાર કરીને તરત ૪ ઉતારી લેવું.)

વનસ્પતિની માહિતી : આ વનસ્પતિ બારેમાસ મળી રહે છે. જેઠ માસમાં ફાંગનાં નવાં પાન આવે છે તેથી પાન તાજાં અને વધુ લીલાં મળી રહે છે. ફાંગ ખેતરની વાડમાં કે જંગલમાં જાડીઝાંખરામાં જોવા મળે છે. તેનું સંવર્ધન બીજ દ્વારા થાય છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : શરીરમાં ઠંડક રહે છે, ગરમી ઘટે છે, આંખોમાં તેજ વધારે છે.

૨૮. ચીલની ડાયી

પ્રેષક : બધીબહેન ખીમજીભાઈ ગણેશભાઈ પટેલ મુ. પિછાણા (બાદરપુર), પો. ક્રીડિયાનગર, તા. રાપર, જિ. કચ્છ

જરૂરી સામગ્રી : ચીલનાં પાન, મીઠું, હળદર, મરચું, બાજરીનો લોટ, છાશ

બનાવવાની રીત : ચીલનાં કુમળા પાનેને બાફી લો. ત્યાર બાદ તેનું પાણી નિતારી લેવું આ પાણી પાછળથી કઢીમાં નાંખી દેવું. આ ભાજીમાં તેમાં મરચું, મીઠું, હળદર અને આશરે ૧૦૦ ગ્રામ બાજરીનો લોટ અને ૧ લિટર જેટલી છાશમાં વધાર કરો. વધાર કર્યા બાદ પથી ૧૦ મિનિટમાં તેને ઉતારી લો.

વનસ્પતિની માહિતી : ચીલ નામની વનસ્પતિ એક નોંધામણ છે, જે ભુલાઈ ગયેલા સ્વાદ ઉપર ભાવિ પેઢીનો અધિકાર

ગુજરાત, રાજ્યસ્થાનમાં વિશેષ થાય છે. શિયાળાની ઋતુમાં ચીલ થાય છે. તેની ઉંચાઈ ૧થી ૨ ફૂટ સુધીની થાય છે. ચીલ જેતરમાં ખાસ જોવા મળે છે અને સંવર્ધન બીજ દ્વારા થાય છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : આંખોમાં ઠંડક આપે, કળતર મટાડે છે.

30. બાવટાના લોટના લાડુ

પ્રેષક : રતનીબહેન ભીમાભાઈ હઠીલા મુ. સરજુમી,
તા. લીમખેડા, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : બાવટાનો લોટ, ગાય/ભેંસનું ધી, ખાંડ/ગોળ, પ્રાક્ષ, નારિયેળનું ટોપરું છીણેલું, ૨૦ ગ્રામ બદામ,
૨૦ ગ્રામ કાજુ, ૨૦ ગ્રામ જાયફણ, ૨૦ ગ્રામ ચારોળી,
૨૦ ગ્રામ ઈલાયચી, ૨૦ ગ્રામ તજ

બનાવવાની રીત : બાવટાના અનાજને બરાબર સાફ કરી કકરો લોટ બનાવી ધીનું મૂઠી વળતું મોણા દઈને રોટલા બનાવો. તે રોટલાને શેકી લઈ બરાબર ખાંડો અથવા મસળો અથવા તો બાવટાના કકરા લોટને ગરમ પાણીથી બાંધી મૂઠિયાં તૈયાર કરી તેને ધીમાં તળી નાખો, તળેલાં મૂઠિયાં ભાંગીને ભુક્કો તૈયાર કરી તેમાં ગરમ ધી તથા ટોપરું, બદામ, કાજુ, જાયફણ, ચારોળી, ઈલાયચી, તજ નાખી લાડું બનાવવા.

વનસ્પતિની માહિતી : બાવટો હલકા વર્ગનો ધાન્ય પાક છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : પૌષ્ટિક ખોરાક છે, પચવામાં હલકો છે.

૩૧. બાવટાના ભજિયાં

પ્રેષક : રતનીબહેન ભીમાભાઈ હઠીલા મુ. સરજુમી,
તા. લીમખેડા, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : ૫૦૦ કિલોગ્રામ લોટ, ૧૫ ગ્રામ હળદર,
૧૫ ગ્રામ ગરમ મસાલો, ૫૦ ગ્રામ કોથમીર, મરીમસાલા
રૂચિ મુજબ

બનાવવાની રીત : બાવટાના અનાજનો ઝીણો લોટ તૈયાર
કરી (દા. ત. ૫ કિલોગ્રામ લોટમાં ૧૫૦ ગ્રામ હળદર,
૧૫૦ ગ્રામ ગરમ મસાલો, ૫૦૦ ગ્રામ કોથમીર)
પાણીમાં નાખી મિશ્રણ તૈયાર કરો. પછી તેલમાં
ભજિયાં તળીને કાઢવાથી ભજિયાં બની જશે.

વનસ્પતિની માહિતી : બાવટો હલકા વર્ગનો ધાન્ય
પાક છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : પૌર્ણિક ખોરાક છે, પચવામાં
હલકો છે.

૩૨. કાળી ડાંગરના પૂસલા

પ્રેષક : રતનીબહેન ભીમાભાઈ હઠીલા મુ. સરજુમી,
તા. લીમખેડા, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : કાળી ડાંગરના ચોખાનો લોટ ૫૦૦ ગ્રામ,
તળવા માટે તેલ, હળદર, મરીમસાલા રૂચિ મુજબ

બનાવવાની રીત : ૧ કિલોગ્રામ મધ્યમ દળેલા લોટમાં પાણી
ઉમેરી ખીરું (રાબ) તૈયાર કરો. તેમાં ૨૫ ગ્રામ હળદર, ૨૦
ગ્રામ મીઠું, ગરમ મસાલો વગેરે ૨૦ ગ્રામ નાખી મિશ્રણ તૈયાર કરી
ભુલાઈ ગયેલા સ્વાદ ઉપર ભાવિ પેણીનો અધિકાર

તેલને ગરમ થવા દઈ સામાન્ય પદ્ધતિથી પૂડા તળીને તૈયાર કરો.

વનસ્પતિની માહિતી : ધાન્ય વર્ગનો પાક છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : પચવામાં હલકો ખોરાક છે.

33. કોદણીની ભસાલે દાઢ ખીચડી

પ્રેષક : રતનીબહેન ભીમાભાઈ હઠીલા મુ. સરજુમી, તા.
લીમખેડા, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : કોદરાની કોદરી, તેલ, ધી, છલાયચી,
જાયફળ, લવિંગ, રાઈ, કોથમીર, આદુ, લસણા, ગરમ
મસાલો, લીલુ મરચું, જીરુ વગેરે

બનાવવાની રીત : કોદરાને એક વાસણામાં સાદા પાણીથી
બેથી ગ્રાણ વાર બરાબર ધોઈ લેવું. એક તપેલામાં તેલ,
ગરમ કરી તેમાં રાઈ-જીરુ નાખી તેલને પાંકું થવા દઈ
તેમાં લીલાં મરચાંના ટુકડા નાખી કોદરી (ધોયેલી)
નાખી બરાબર ચડવા દેવું. જરૂરિયાત મુજબ પાણી
મીઠું વગેરે નાખવું.

નોંધ : આ ખીચડીમાં ફલાવર, વટાણા, બટાકા, ટામેટો
નાંખીને વેળુટેબલ ખીચડી પણ બનાવી શકાય.

વનસ્પતિની માહિતી : કોદરા એક હલકા વર્ગનો ધાન્ય પાક
છે. ચોમાસુ ઋતુમાં તેનું વાવેતર કરવામાં આવે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : અશક્ત વ્યક્તિ સશક્ત બને છે.
પાચનશક્તિમાં હલકો ખોરાક છે. શરીરની તંદુરસ્તી વધારે
છે. શરીરને જરૂરી પોષક તત્ત્વો મળે છે. નાનાં બાળકો અને
બીમાર વૃદ્ધ વ્યક્તિઓ માટે પાચક અને ઉત્તમ ખોરાક છે.

૩૪. કાંગની કોદટીમાંથી શીઠો

પ્રેષક : શકુબહેન ગજાભાઈ હઠીલા મુ. સરજુમી, તા. લીમખેડા,
જિ. દાહોદ

જરૂરી સામગ્રી: ૫૦૦ ગ્રામ કાંગની કોદરીનો કકરો લોટ,
૨૦૦ ગ્રામ ધી, ૨૦૦ ગ્રામ ગોળ, બદામ, જાયફળ,
ઇલાયચી, દ્રાક્ષ, ચારોળી, કાજુ, તજ, છીણોલું કોપરું જરૂર
મુજબ લેવું.

બનાવવાની રીત : કાંગના લોટને ધીમાં રાતો થાય ત્યાં
સુધી સેકવો. ત્યારબાદ ગરમ પાણી તથા ગોળ, અલચી,
કાજુ, બદામ, દ્રાક્ષ નાખી હલાવતા જવું. એકદમ
સ્વાદિષ્ટ શીરો તૈયાર.

વનસ્પતિની માહિતી : હલકા ધાન્ય વર્ગનો પાક છે.
ત્રણ-પાંચ ફૂટ જે ટલો ઉંચો છોડ થાય છે. ૭૦ દિવસમાં
પાકી જાય છે. ત્રણથી ચાર વર્ષ સુધી અનાજ સર્તું
નથી. મકાઈ સાથે કાંગનો મિશ્ર પાક થાય છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : પચવામાં સરળ છે. પોષક તત્ત્વોથી
ભરપૂર છે. પ્રસૂતિમાં ખવાય છે.

૩૫. કાંદાગોળાનું શાક બનાવવું

પ્રેષક : રૂપાભાઈ હિંચભાઈ હઠીલા (૮૫ વર્ષ) મુ. સરજુમી,
તા. લીમખેડા, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : ૫૦૦ ગ્રામ કાંદાગોળા, તેલ, મરીમસાલા
રૂચિ મુજબ

બનાવવાની રીત : કાંદાગોળાને બટાટાંની જેમ યોગ્ય રીતે બાફી

ભુલાઈ ગયેલા સ્વાદ ઉપર ભાવિ પેણીનો અધિકાર

ઉપરની છાલ કાઢી નાખી તેના ટુકડા કરી સામાન્ય શાકની જેમ વધાર કરી અન્ય મરીમસાલા વગેરે નાખી શાક તૈયાર કરવું.

વનસ્પતિની માહિતી : સામાન્ય રીતે વાડ ઉપર કે ખેતરમાં વેલા તૈયાર થાય છે. તેથી ઘરે જ મળી રહે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : સંપૂર્ણ પાચક શાક છે. કુદરતી પોષક તત્ત્વો સારા પ્રમાણમાં છે. પેટ હળવું થઈ જાય છે.

39. ગોરસ આમલીનાં ફળનું શાક

પ્રેષક : ભુરીબેન ફ્લાબાઈ મુ. સલિયાટા, પો. બલૈયા, તા. ફિલેપુર, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : ગોરસ આમલીનાં ફળ, દઢી, તેલ જરૂરી મરી-મસાલા

બનાવવાની રીત : ફળને ફોલી તેમાંથી ઠળિયા કાઢી લઈ એક તપેલામાં બાણી પાણીનો નિતાર કરી દઈ તે ઠળિયાને વધાર કરી સંપૂર્ણ મરીમસાલા (શાકમાં ઉપયોગી) નાખી તેમાં દઢી નાખી શાક તૈયાર થઈ ગયા પછી ઉતારી લેવું.

વનસ્પતિની માહિતી : ગોરસ આમલીનું જાડ હોય છે. તેનાં ફૂલ સફેદ-ભૂરાં હોય છે. ફેબ્રુઆરી-માર્ચમાં ફળ આવે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : કબજ્જ્યાત કે અપચો દૂર થાય છે.

39. ગોગાડી (ગોગાડી)નું શાક

પ્રેષક : સુરેખાબહેન પરખોતમભાઈ પટેલ મુ. આંકલી,
દેવગઢબારિયા, જિ. દાહોદ

અન્ન એવો ઓડકાર

તા.

જરૂરી સામગ્રી : ગોગદીનું ફળ, તેલ, મીઠું, મરચું, હળદર

બનાવવાની રીત : ગોગદીનાં તાજાં ફળ લઈ ઉપરની છાલ કાઢી લઈ તેના ટુકડા કરી બાઝી નાખો. ત્યાર બાદ તેને તેલમાં વધારી મીઠું, મરચું, ધાળાળું, હળદર નાખો.

વનસ્પતિની માહિતી : ગોગદીનું જાડ થાય છે. તેનાં ફૂલ સફેદ રંગનાં થાય છે. તેનાં પાનનો આકાર જમફળનાં પાન જેવો હોય છે. મે-જૂનમાં ફૂલ-ફળ આવે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : પેટના દર્દ મટકે છે. જાડા થતા હોય તેવા બ્યક્ટીને ખવડાવવાથી જાડા મટી જાય છે.

૩૮. ગરણાં આંબળાંની છુકવણી

પ્રેષક : સાધના ગુપ્તા

જરૂરી સામગ્રી : ૧ કિલો આંબળાં, ૧ વાટકી પાણી, ૧.૨૫ કિલો ખાંડ

બનાવવાની રીત : આંબળાંને સારી રીતે ધોઈને એક વાટકી પાણી ફૂકરમાં મૂકી એક સીટી વાગે ત્યાં સુધી બાફવા. ત્યાર બાદ ઠંડાં પડે એટલે આંબળાની પેશી છૂટી પાડીને ઠળિયો કાઢી નાખો. આંબળાં બાફતાં વધેલું પાણી અન્ય ઉપયોગમાં લઈ શકાય. ઠળિયા કાઢ્યા બાદ આંબળાંમાં બધી ખાંડ નાખીને એક તપેલીમાં ત્રાશ દિવસ ઘરમાં ૪ રહેવા દો તથા રોજ એક વાર હલાવો. ત્યાર બાદ એક ચારણીમાં આંબળાં નાખીને ચાસણી નિતારી લો. ચાસણી નીતરી જાય પછી આંબળાંને એક કપડા ઉપર એક-એક કરીને અલગ કરો. અઠવાડિયા સુધી તડકા-છાયામાં સૂકવો. આ આંબળાંને ગરમીના દિવસોમાં ચૂસવાથી તરસ છીપે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : આ વાનગીથી પાંચનંતરના રોગ મટે છે તેમ જ શરીરમાં સ્કૂર્ટિ રહે છે. આંખોનું તેજ વધે છે. ગરમીના દિવસોમાં ચૂસવાથી તરસ છીપે છે.

૩૬. ખાટી ભીડીનાં ફૂલનું શરબત

પ્રેષક : ધીરેન્દ્ર સિમિતા મુ. સાકવા, પો. સમારિયા,
તા. રાજપીપળા, જિ. નર્મદા

જરૂરી સામગ્રી : ભીડીનાં ફૂલનો ભૂકો બે ચમચી, ખાંડ
ત્રણ ચમચી, મીઠું અને વાટેલું ચપટીભર જીરુ.

બનાવવાની રીત : ખાટી ભીડીનાં ફૂલનો ભૂકો ૧૦થી
૧૫ મિનિટ પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ તેમાં
ખાંડ, મીઠું અને જીરુ નાખવું. બધું હલાવી નાખો.
આમાંથી ત્રણ ઘાલા શરબત તૈયાર થશે.

વનસ્પતિની માહિતી : ખાટી ભીડીનો ઉપયોગ આંબલીના
વિકલ્પ રૂપે કરી શકાય છે અને તેનો પાઉડર આખું વર્ષ
સાચવી શકાય છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : શરીરને ઠંડક અને સ્કૂર્ટિ આપે છે.

૪૦. બોરકૂટ

પ્રેષક : ધીરેન્દ્ર સિમિતા મુ. સાકવા, પો. સમારિયા,
તા. રાજપીપળા, જિ. નર્મદા

જરૂરી સામગ્રી : દેશી બોરડીનાં સૂકવેલાં બોરનો પાઉડર ૧
કિલો, ૧૫૦ ગ્રામ બૂરું ખાંડ, મીઠું ૧૦ ગ્રામ

બનાવવાની રીત : દેશી બોરડીનાં પાકેલાં બોરને સૂકવી દો. આ
અન્ન એવો ઓડકાર

વીસરાતી વાનગીઓ

સૂકવેલ બોરની કોકડીને મોટી ઘંટીમાં ભરડી નાખો. તેમાં રહેલા આખા તથા તુટેલા ઠળિયાના મોટા ટુકડા વીણી લઈ ફરી જીણું દળો. તેમાં ૧ કિલો પાઉડરમાં ૧૫૦ ગ્રામ બૂરું ખાંડ અને ૧૦ ગ્રામ મીઠું ઉમેરીને મેંદાની ચારણીથી ચાળીને ડબામાં ભરી દો.

સ્વાસ્થ્ય ઉપર અસર : શરીરને ઠંડક અને સ્ક્રૂર્ટિંગ આપે છે.

૪૧. દૂધની ચોકલેટ

પ્રેષક : ધીરેન્દ્ર સ્મિતા મુ. સાકવા, પો. સમારિયા, તા. રાજ્યીપળા, જિ. નર્મદા

જરૂરી સામગ્રી : ૧ લિટર દૂધ, ૩૦૦ ગ્રામ ગોળ, કોપરાંની છીણ અડધી વાટકી

બનાવવાની રીત : દૂધને ઉકાળીને તેનો માવો બનાવવો. તેમાં ગોળ નાખીને હલાવતાં રહેવું. મિશ્રણ સાધારણ ઘણું થાય એટલે કોપરાંનું છીણ ઉમેરી દેવું. ત્યાર બાદ મનપસંદ આકારની ચોકલેટ બનાવો. આઠથી દસ ગ્રામની એક તેવી કુંઠી વધુ ચોકલેટ બને છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : બળવર્ધક છે.

૪૨. શીમળાનાં મૂળનો હલવો

પ્રેષક : રામપાલ ગુજર મુ. સમરા, તા. થાનાગાજી, જિ. અલવર

જરૂરી સામગ્રી : શીમળાનાં મૂળ, ધી અને સાકર

બનાવવાની રીત : શીમળાનાં મૂળને જમીનમાંથી ખોદીને કાપી લો. ભુલાઈ ગયેલા સ્વાદ ઉપર ભાવિ પેઢીનો અધિકાર

તેને બયાટાંની જેમ બાઝીને તેનો ગર કરીને ધીમાં સાંતળી જરૂર મુજબ સાકર નાખી ખાવાના ઉપયોગમાં લો.

સ્વાસ્થ્ય ઉપર અસર : વાનું દર્દ મટે છે. શક્તિવર્ધક

૪૩. ફાંગનું શાસ

પ્રેષક : લાલીબહેન રાજભાઈ ગમાર, જમનાબહેન શાંતિભાઈ ગમાર

જરૂરી સામગ્રી : ફાંગનાં પાન ૫૦૦ ગ્રામ, ખટાશ માટે ખાટી છાશ, કેરી અથવા આંબલી, તેલ, રાઈ, જીરુ, મરચું, મીઠું, હળદર, ધાણાજીરુ જરૂર મુજબ

બનાવવાની રીત : ફાંગનાં પાનને ધોઈને જીણાં જીણાં સમારી લો. ત્યાર બાદ કઢાઈમાં તેલ મૂકીને પાન વધારો, મસાલો તથા જરૂર મુજબ ખાટી છાશ, કેરી અથવા આંબલીની ખટાશ નાખો અને થોડી વાર ચઢવા દેવું. ફાંગની સ્વાદિષ્ટ ભાજ તૈયાર થઈ જશે.

વનસ્પતિની જાણકારી : ફાંગનો વેલો થાય છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : ઉધરસ થઈ હોય તો ભાજ બનાવીને ખાવામાં આવે છે. ઘઉંના લોટમાં ભેળવી રોટલા બનાવવામાં આવે છે, જેનાથી શક્તિ મળે છે.

૪૪. કરમદાંનું શાસ

પ્રેષક : રામીબહેન હીરાભાઈ ગમાર, બબીબહેન દેવાભાઈ ગમાર

જરૂરી સામગ્રી : કરમદાં ૫૦૦ ગ્રામ, તેલ, રાઈ, જીરુ, મરચું, મીઠું, હળદર, ધાણાજીરુ જરૂર મુજબ

અન્ન એવો ઓડકાર

બનાવવાની રીત : કઢાઈમાં તેલ મૂકીને રાઈ, જુદુ નાખી કરમદાં વધારો. ત્યાર બાદ બધો મસાલો નાખો અને પાંચ મિનિટ ચઢવા દેવું. ઘઉંની રોટલી, જુવાર, બાજરી, મકાઈના રોટલા સાથે તમારી મરજુ મુજબ ખાઈ શકો છો.

વનસ્પતિની જાણકારી : ખાટાં હોવાથી સ્વાદિષ્ટ લાગે છે

■ ૪૫. ગુંડાંની ભાજી

પ્રેષક : સોનીબહેન સબળાભાઈ ગમાર, બબીબહેન દેવાભાઈ ગમાર

જરૂરી સામગ્રી : ગુંડાંનાં પાન ૫૦૦ ગ્રામ, તેલ, રાઈ, જુદુ, મરચું, મીઠું, હળદર, ધાણાજુદુ ૪૩૨ મુજબ

બનાવવાની રીત : કઢાઈમાં તેલ મૂકીને રાઈ, જુદુ નાખી ગુંડાંનાં પાન જીણાં સમારીને વધારો. ત્યાર બાદ બધો મસાલો નાખો અને પાંચ મિનિટ ચઢવા દો. સ્વાદિષ્ટ શાક તૈયાર. ઘઉંની રોટલી, જુવાર, બાજરી, મકાઈના રોટલા સાથે તમારી મરજુ મુજબ ખાઈ શકો છો.

સ્વાસ્થ્ય ઉપર અસર : શરદી થઈ હોય ત્યારે ખાવાથી ફાયદો થાય છે અને આંતરડાં સાફ થાય છે.

■ ૪૬. રજકાનું શાક

પ્રેષક : ધુળીબહેન ભુલાભાઈ ગમાર, બબીબહેન દેવાભાઈ ગમાર

જરૂરી સામગ્રી : રજકાનાં પાન ૫૦૦ ગ્રામ, તેલ, રાઈ, જુદુ, મરચું, ભુલાઈ ગયેલા સ્વાદ ઉપર ભાવિ પેણીનો અધિકાર

મીહું, હળદર, ધાણાજીરુ જરૂર મુજબ

બનાવવાની રીત : કદાઈમાં તેલ મૂકીને રાઈ, જરુ નાખી રજકાનાં પાન જીણાં સમારી વધારો. ત્યાર બાદ બધો મસાલો નાખો અને થોડી વાર ચઢવા દો. નવીન સ્વાદસભર શાક તૈયાર. ઘઉંની રોટલી, જુવાર, બાજરી, મકાઈના રોટલા સાથે તમારી મરજ મુજબ ખાઈ શકો છો.

૪૭. કુદીનો ડુવો/દોંસ

પ્રેષક : બબીબહેન દેવાભાઈ ગમાર

જરૂરી સામગ્રી : કુરી ૨૫૦ ગ્રામ, છાશ, મીહું જરૂર મુજબ

બનાવવાની રીત : કુરીને પાણી અને છાશમાં ધીમા તાપે ચઢવા દો. જરૂર મુજબ મીહું નાખી હલાવતાં રહો. દાણો એકદમ ચઢી જાય એટલે દુવો તૈયાર. તેને છાશ અને ધી સાથે ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

૪૮. કુદીનો શીઠો

પ્રેષક : બબીબહેન દેવાભાઈ ગમાર

જરૂરી સામગ્રી : કુરીનો કકરો લોટ ૨૫૦ ગ્રામ, મધ અને ધી

બનાવવાની રીત : ધીમાં કુરીનો લોટ ધીમા તાપે સાંતળો. થોડો લાલ થાય એટલે ગરમ પાણી નાખી હલાવો તથા ગળપણ માટે મધ નાખો. અસલ કુદરતી સ્વાદથી ભરપૂર કુરીનો શીરો ખાવ તો જિંદગીભર તેનો સ્વાદ ન ભુલાય.

૪૯. ખાટી આંબલીનાં પાનનું શાસ

પ્રેષક : બબીબહેન દેવાભાઈ ગમાર

જરૂરી સામગ્રી : ખાટી આંબલીનાં પાન ૫૦૦ ગ્રામ, તેલ, રાઈ,
જીરુ, મરચુ, મીઠું, હળદર, ધાણાજીરુ, ગોળ જરૂર મુજબ

બનાવવાની રીત : કટાઈમાં તેલ મૂકીને રાઈ, જીરુ નાખી
આંબલીનાં પાન વધારો. ત્યાર બાદ બધો મસાલો નાખો
અને થોડી વાર ચઢવા દો. ખટમીઠું શાક તૈયાર. ઘઉંની
રોટલી, જુવાર, બાજરી, મકાઈના રોટલા સાથે તમારી
મરજ મુજબ ખાઈ શકો છો.

૫૦. મહુડાંની કટી

પ્રેષક : બબીબહેન દેવાભાઈ ગમાર

જરૂરી સામગ્રી : મહુડાંનાં ફૂલ લીલાં અથવા સૂકવેલાં,
મધ, ધી, ગોળ, છાશ

બનાવવાની રીત : કટાઈમાં ધી મૂકી મહુડાંનાં ફૂલ વધારો.
તેમાં છાશ અને ગોળ નાખી ચઢવા દો. ખાતી વખતે
તેમાં થોડું મધ અને ધી નાખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે
છે.

૫૧. ગુવાનનાં પાનની ભાજી

પ્રેષક : કાન્તાબહેન ગોવિંદભાઈ છગનભાઈ પટેલ
મુ. જાખલા, તા. ઉમરેઠ, જિ. આણંદ

જરૂરી સામગ્રી : ગુવારનાં છથી સાત દિવસનાં કુમળાં પાન, લસણ,
તેલ, રાઈ, જીરુ, મરચુ, મીઠું, હળદર, ધાણાજીરુ જરૂર મુજબ

બનાવવાની રીત : ગુવારનાં પાનને જીણાં સમારી તેલ, રાઈ, જીરું
અને લસણ નાખી વધાર કરો. જરૂરી મસાલા નાખી ધીમા તાપે
ચઢવા દો. ચોમાસામાં વરસાદ પડતાંની સાથે તાજું શાક
મળતું નથી ત્યારે ગુવારનાં પાનની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક
ભાજી ઘેરબેઠાં મળી રહે છે.

પર. અરણીનાં ફૂલની કટી

પ્રેષક : કાન્તાબહેન ગોવિંદભાઈ છગનભાઈ પટેલ
મુ. જાખલા, તા. ઉમરેઠ, જિ. આણંદ
જરૂરી સામગ્રી : ચણાનો લોટ, છાશ અને એક ખોબો
અરણીનાં ફૂલ, લસણ, તેલ, રાઈ, જીરું, મરચું, મીઠું,
હળદર, ધાળાજીરું જરૂર મુજબ.

બનાવવાની રીત : વાસણામાં તેલ ગરમ કરી રાઈ,
મેથી, લસણ અને જીરુનો વધાર કરી અરણીનાં ફૂલ
નાખી હલાવો. ફૂલને સાધારણ શેક્યા બાદ તેમાં
છાશ અને ચણાના લોટનું મિશ્રણ ઉમેરવું. જરૂર મુજબ
મસાલા ઉમેરી આઠથી દસ મિનિટ ધીમા તાપે હલાવતાં-
હલાવતાં ઉકાળો. બે-ત્રણ ઉભરા આવે એટલે કઢી
ઉતારી લઈ રોટલા કે રોટલી સાથે ખાવ.

સ્વાસ્થ્ય ઉપર અસર : અરણીનાં ફૂલની કઢી દિવસમાં
એક વખત. એ રીતે સતત ચાર દિવસ ખાવાથી પગના
સાંધાનો વા તથા સંધિવા મટી જાય છે.

પર. કોકી વેલાના પાનની ભાજી

પ્રેષક : કાન્તાબહેન ગોવિંદભાઈ છગનભાઈ પટેલ
અનું એવો ઓડકાર

મુ. જાખલા, તા. ઉમરેઠ, જિ. આણંદ

જરૂરી સામગ્રી : ડોડી વેલના પાન ૫૦૦ ગ્રામ, તેલ, રાઈ, જીરુ, મરચુ, મીહું, હળદર, ધાણાજરુ જરૂર મુજબ

બનાવવાની રીત : ડોડી (લેખ્ટાડેનીયા રેટીક્યુલાટા) વેલના કુમળા પાન તોડી પાણીથી ધોયા બાદ ઉપર મુજબ જ તેલ અને ગરમ ભસાલાનો વધાર કરી શાક બનાવવું. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

વનસ્પતિની જાણકારી : આ વનસ્પતિના ગુચ્છામાં આઇએપીળા રંગના ફૂલ અને પરવળ જેવા કદમાં ફળ બેસે છે. તે ફાટે ત્યારે તેમાંથી રૂ જેવું નીકળે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : ડોડીના પાન આંખોનું તેજ વધારે છે.

૫૪. ખીજડાની સીંગાનું થાક

પ્રેષક : નાથીબહેન માવજીભાઈ સોનારા મુ. મેટાલ, તા. બાવળા, જિ. અમદાવાદ

જરૂરી સામગ્રી : ખીજડાની સીંગાનું ૫૦૦ ગ્રામ, તેલ, રાઈ, જીરુ, મરચુ, મીહું, હળદર, ધાણાજરુ જરૂર મુજબ

બનાવવાની રીત : ખીજડાની સીંગાનું સાફ કરી સમારી નાખો. ત્યાર બાદ તે સીંગાનું બાફવા મૂકો. આ બાફેલી સીંગાનું તેલમાં વધારી તેમાં છાશ નાખો. તેમાં સ્વાદ ગ્રમાણો મરચું, મીહું, હળદર ધાણાજરુ નાખી ઉકાળો.

વનસ્પતિની માહિતી : આ ઝાડ ૨૦થી ૨૫ ફૂટ ઊંચું થાય છે અને ખેતરના શેઢા-પાળા તથા જંગલોમાં જોવા મળે છે.

પં. શૂરીનાં કંદનું શાક

પ્રેષક : અભેસિંહ અનોપસિંહ બારિયા, મુ. વેડ, તા. ધાનપુર,
જિ. દાહોદ

જરૂરી સામગ્રી : સૂરીનાં કંદ ૫૦૦ ગ્રામ, તેલ, રાઈ, જીરુ,
મરચું, મીઠું, હળદર, ધાણાજીરુ જરૂર મુજબ

બનાવવાની રીત : સૂરીનાં કંદ સાફ કરી ટુકડા કરો. ત્યાર
બાદ તેને પાણીમાં બાફીલો. પછી તેને તેલમાં વધારી
જરૂર મુજબ મસાલા નાખો.

વનસ્પતિની માહિતી : આ વનસ્પતિ જંગલમાં થાય
છે. વેલ થાય છે. તેનું કંદ જમીનમાં બેસે છે. એક છોડ
ઉપર ઉથી ૪ કિલોનું કંદ મળે છે. આ વેલ ચોમાસામાં
જોવા મળે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : પાચનશક્તિમાં વધારો થાય છે.

પક. આંબલિયાંનું શાક

પ્રેષક : નરવતભાઈ મોહનભાઈ બારિયા, મુ. ધાનપુર,
તા. ધાનપુર, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : આંબલિયાના કંદ ૫૦૦ ગ્રામ, તેલ,
રાઈ, જીરુ, મરચું, મીઠું, હળદર, ધાણાજીરુ જરૂર મુજબ

બનાવવાની રીત : આંબલિયાંનો કંદ લાવી સાફ કરી તેને
પાણીમાં બરાબર ઉકાળો અને ઉકાળ્યા બાદ તેની ઉપરની
છાલ ઉતારી તેના ટુકડા કરી તેલમાં વધારી જરૂર મુજબ
મસાલા નાખો.

વનસ્પતિની માહિતી : આ વનસ્પતિ જંગલમાં થાય છે. તેનો વેલો થાય
અનુ એવો ઓડકાર

ઇ. વેલા ઉપર બકરીના આંચળ જેવા આકારનાં ફળ આવે છે. ઓક્ટોભર-નવેભર માસમાં ફળ આવે છે. આ વનસ્પતિના કંદ તથા ફળ બજ્જોનું શાક થાય છે.

૫૭. કળથીનું શાક

પ્રેષક : જમનાબહેન જવેરભાઈ દેસાઈ (શતાયુષી), ગામ. ચિરોડા, તા. ગઢા, જિ. ભાવનગર

જરૂરી સામગ્રી : કળથીનાં બીજ

બનાવવાની રીત : કળથીનાં બીજને પાણીમાં બે કલાક બાફી રાખો. ત્યાર બાદ તેનો વધાર કરી શાક બનાવો. મગા, મઠ જેવા કઠોળને બાફીને વધારીએ તે જ રીતે કળથીનું પણ વધાર કરીને શાક બનાવવું. તેમાં રૂચિ મુજબ મરચું, મીઠું અને મસાલા નાખવા.

વનસ્પતિની માહિતી : કળથી એ સામાન્ય રીતે હલકા વર્ગનું કઠોળ છે, જેનો છોડ વેલા સ્વરૂપે બેથી અઢી ફૂટ જેટલો વધેલો જેવા મળે છે. ક્યારેક જમીન ઉપર વેલાની જેમ પથરાઈ જાય છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : કળથી પથરીના દર્દીઓ માટે ઉત્તમ ખોરાક છે. કળથીનું શાક ખાવાથી શરીરમાં શક્તિ વધે છે. સાંધાના દુખાવા મટી જાય છે.

૫૮. વાસોટીની બાજુ

પ્રેષક : ગંગાબહેન રામજીભાઈ મકવાણા (શતાયુષી)

ગામ.

સમદિયાળા, તા. ઉમરાડા, જિ. ભાવનગર

બુલાઈ ગયેલા સ્વાદ ઉપર ભાવિ પેઢીનો અધિકાર

જરૂરી સામગ્રી : વાસોટીનાં પાન, મરચું, તેલ વગેરે

બનાવવાની રીત : વાસોટી નામની વનસ્પતિનાં લીલાં ફૂણાં પાન લાવી તેને જીણાં સમારી તેમાં સપ્રમાણ મરચું, મીહું અને તેલ નાખી વધારો. વાસોટીના શાકમાં પાણી નાખવું નહિ. વધાર્યા બાદ પાંચ કે સાત મિનિટ ચૂલા ઉપર રાખ્યા પછી ઉતારી લેવુ. તે ઝડપથી ચઢી જાય છે.

વનસ્પતિની માહિતી : વાસુટી નામની વનસ્પતિ વેલા સ્વરૂપે હોય છે, જે ખાસ કરીને થોરિયાની વાડ કે વૃક્ષો ઉપર જોવા મળે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : આંખોમાં તેજ વધારે છે.

૫૮. બ્રાહ્મીનું થાક

પ્રેષક : શ્રીમતિ અર્યનાભહેન ગોપાલદાસ ધોખ
(ઉત્તરાંધ્રા)

જરૂરી સામગ્રી : બ્રાહ્મીના પાન, ગાયનું ધી, જરૂ,

બનાવવાની રીત : બ્રાહ્મીના પાન લાવી પાણીથી ધોઈ નાખો. પાણીમાં ધોય પછી તેને સુકવી નાખો. સુકાય ગયા બાદ ચખ્યાથી કાપીને તેમાં ગાયનું ધી એક ચમચી અને જરૂ નાખીને ફાય કરીને ભાજી બનાવો.

વનસ્પતિની જાણકારી : બ્રાહ્મી એ એક પ્રકારની ઔષધિ છે.

બ્રાહ્મી નામની વનસ્પતિનો વેલો થાય છે. તેના પાન અતિશય કડવા હોય છે. પિયત વાળા વિસ્તારમાં બારેમાસ મળે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : મગજને તેજ બનાવે છે. પેટમાં રહેલ કુમિનો નાશ કરે છે. ચામડીની ખુંજલી નષ્ટ કરે છે. તાવમાં ફાયદો કરે છે.

૭૦. પીપળના ટેટાનું શાક

પ્રેષક : કાળીબહેન ડાચાભાઈ ચૌહાણ (શતાયુષી)

ગામ. વનાળી, તા. ગઢા, જિ. ભાવનગર

જરૂરી સામગ્રી : પીપળના ટેટા, મરચું, તેલ વગેરે

બનાવવાની રીત : પીપળના ટેટા ઉનાળાની ઝતુમાં જોવા મળે છે. આ ટેટા લાવી તેને સામાન્ય બાફીને અન્ય શાકની જેમ વધારી નાખો.

વનસ્પતિની માહિતી : પીપળ વડ જેવું વૃક્ષ છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : પીપળના ટેટાને ખાવાથી શરીરમાં સ્કૂર્ટિ વધે છે.

૭૧. ટિંડોળીના પાનનું શાક

પ્રેષક : શ્રીમતિ નંદીતાબહેન શ્રી નેપાલદાસ બર્મન (ઉત્તરાંચલ)

જરૂરી સામગ્રી : ટિંડોળીના પાન, તેલ, લાલ મરચું, જરૂ, મીઠું

બનાવવાની રીત : ટિંડોળીના પાન તોડી લાવીને ચોખ્ખા પાણીમાં ધોઈ સાફ કરી સમારી નાખો. ત્યારબાદ કઢાઈમાં તેલ મુકીને જરૂ નાખો ટિંડોળીના સમારેલા પાનનો વધાર કરો. ત્યાર બાદ બધો મસાલો નાખો.

સ્વાસ્થ્ય ઉપર અસર : ટિંડોળીના પાન તેલમાં વાટી મિક્સ કરી માથામાં લગાડવાથી માથાનો દુઃખાવો મટે છે. પેટને ઠંડુ રાખે છે.

૭૨. સરગવાના પાનના ભજિયા

પ્રેષક : શ્રીમતિ નંદીતાબહેન શ્રી નેપાલદાસ બર્મન
જરૂરી સામગ્રી : ૨૫૦ ગ્રામ સરગવાના પાન, ૫૦૦ ગ્રામ ચણાનો લોટ, મરચું, હળદર, મીઠું, જરૂ, તેલ
બનાવવાની રીત : ચણાના લોટમાં સરગવાના પાન વીજી લાવીને સાફ કરી જીણા સમારી લો. ત્યાર બાદ ચણાના લોટમાં આ સમારેલા પાન તથા મરચું, હળદર, મીઠું નાખી ખીરું તૈયાર કરો. આ ખીરામાંથી ગરમા ગરમ સરગવાના ભજિયા ઉતારો.

સ્વાસ્થ્ય ઉપર અસર : કોઈ પણ વ્યક્તિ બિમાર થઈ ગયો હોય અને મોહુ ખરાબ થઈ ગયું હોય તો આના પકોડા ખાવાથી મોહું સારુ થાય છે.

૭૩. કેળાના ફૂલનું શાડ

પ્રેષક : શ્રીમતિ આશા વિશ્વાસ(ઉત્તરાંચલ)

જરૂરી સામગ્રી : કેળાના ફૂલ, તેલ, હળદર, મીઠું, મરચા, જરૂ

બનાવવાની રીત : કેળાના ફૂલ લાવી પાણીમાં ધોઈ સાફ કરી તેલમાં જરૂ નાખી વધાર કરી નાખો. ત્યાર બાદ તેમાં મરચું, મીઠું, હળદર નાખી શાક બનાવવું.

૭૪. કોળાના ફૂલની ચથણી

પ્રેષક : શ્રીમતિ અર્યનાબહેન ગોપાલદાસ ધોખ (ઉત્તરાંચલ)

જરૂરી સામગ્રી : કોળાના ફૂલ, જરૂર, લસણ, તેલ, મીઠું

બનાવવાની રીત : કોળાના તંદુરસ્ત ફૂલ લાવી સાફ કરો.
તેને વાટીને તેની અંદર જરૂર, લસણ, તેલ, મીઠું નાખીને
ચટણી બનાવો.

વનસ્પતિની જાણકારી : ખૂબ જ શક્તિ વર્ધક છે.

કારણ કે તેના છોડને ફળ નથી આવતા. આના
પકોડા પણ બને છે.

૭૫. કાચી કેદીના પાપડ

પ્રેષક : શ્રીમતિ અર્યનાબહેન ગોપાલદાસ ધોખ
(ઉત્તરાંચલ)

જરૂરી સામગ્રી : કાચી કેરી, ખાંડ, મીઠું

બનાવવાની રીત : કાચી કેરીને સાફ કરી છીણીથી છીણી
લો અને પછી પાણી નાખીને રસ જાડો થાય ત્યાં સુધી
ઉકાળો. ત્યાર બાદ તેને એક થાળીમાં નાખવો અને તેની
અંદર ખાંડ તથા મીઠું નાખીને ઠંડો કરો જેથી એક દિવસમાં
પાપડ બની જાય છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : વિટામીન સી મળે છે. રૂચિકારક છે.

૬૬. રોટલા।

(૧) મહુડાંના રોટલા।

પ્રેષક : છાયાબહેન રામાભાઈ

જરૂરી સામગ્રી : મહુડાંનાં ફૂલ ૫૦૦ ગ્રામ, ખરસાંડીનાં બીજ ૧૦૦ ગ્રામ, મીઠું ૧ ચમચી પાણી અડધો ગલાસ બનાવવાની રીત : મહુડાંનાં સૂકાં ફૂલ આશરે ૫૦૦ ગ્રામ, ૧૦૦ ગ્રામ ખરસાંડી બન્ને ભેગું કરીને ખાંડણીમાં (લાકડાની માંડળી) ખાંડીને તાવડીમાં નાખવામાં આવે છે. ત્યાર બાદ તેમાં ભજો તેટલું પાણી નાખીને સ્ટીલની વાટકી વડે દબાણ આપવામાં આવે છે, જેથી માતરની જેમ તે પડ બની જાય છે. તે પછી તેને બરાબર શેકવામાં આવે છે. લોખડાની તાવડી વધારે અનુકૂળ આવે છે, જેથી દાબ થઈ શકાય છે. ૫૦૦ ગ્રામ ફૂલના રથી ઉ રોટલા થઈ શકે છે, જે રોટલા સંજી સાથે ખવાય છે.

વનસ્પતિની માહિતી : મહુડાંનું મોટું વૃક્ષ થાય છે, તેનાં ફૂલને મહુડાં કહે છે, તેના ફળ અને તેલ ખોરાક તરીકે ઉપયોગી થાય છે. જંગલ, જેતરો, નદીઓ વગેરે જગ્યા ઉપરથી મળી રહે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : શરીરનું કળતર અને સાંધા દુઃખતા હોય તો તે મટી જાય છે.

હાડકું તુટ્યું હોય તો જલદી આરામ થઈ જાય છે.

(૨) કોદરાનો રોટલા

પ્રેષક : વીનાબહેન શીનાભાઈ હઠીલા (પટેલ ફળિયું) શકુબહેન રવજ્જભાઈ હઠીલા (વગવડી ફળિયું) મું. સરજુમી, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : કોદરા

બનાવવાની રીત : કોદરા દળીને તેના લોટનો રોટલો બનાવી તવીમાં શેકી નાખો.

વનસ્પતિની માહિતી : કોદરા એક હલકા વર્ગનો ધાન્ય પાક છે. ચોમાસુ ઝાતુમાં વાવેતર કરવામાં આવે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : અશક્ત વ્યક્તિ સશક્ત બને છે. પાચન-શક્તિમાં હલકો ખોરાક છે. શરીરની તંદુરસ્તી વધારે છે. નાનાં બાળકો અને બીમાર વૃદ્ધ વ્યક્તિઓ માટે પાચક અને ઉત્તમ ખોરાક છે.

(૩) ટીમરુનાં છાલના રોટલા

પ્રેષક : જગદીશભાઈ રાયસિંગભાઈ ભુરિયા (જાલિયાપાડા), વિનુભાઈ રૂપસિંગભાઈ ડાંડોર (વાવડી ફળિયું), મું. સરજુમી, તા. લીમખેડા, જિ. દાહોદ

જરૂરી સામગ્રી : ટીમરુ

બનાવવાની રીત : ટીમરુનાં છાલાં જંગલમાંથી લાવી ખાંડી અને દળીને તેના રોટલા બનાવી શેકી નાખો.

વનસ્પતિની માહિતી : ટીમરુનું મોટું જાડ થાય છે. ટીમરુના થડનો રંગ કાળો હોય છે. દુષ્કાળ સમયે ટીમરુનાં છાલાંના રોટલા બનાવી ખવાય છે.

(૪) ભોયરીંગણીના રોટલા

પ્રેષક : ગંગાબહેન રામજીભાઈ મકવાણા (શતાયુભી)

ગામ. સમદ્ધિયાળા, તા. ઉમરાડા, જિ. ભાવનગર

જરૂરી સામગ્રી : ભોયરીંગણી (ભોટંગડી), બાજરાનો લોટ
બનાવવાની રીત : ભોયરીંગણીનાં પાકાં ફળમાંથી બીજ
 કાઢી તેને બેથી ત્રણા વાર પાણીથી ધોઈ નાખો. ત્યાર
 બાદ એક દિવસ સુકાવા દો. આ બીજ સુકાઈ ગયા
 બાદ ખાંડણિયામાં ખાંડી નાખો અને થોડો જુવાર કે
 બાજરાનો લોટ નાખો. ત્યાર બાદ તેના રોટલા બનાવવા,
 જે સ્વાદમાં બહુ જ મીઠા લાગે છે.

વનસ્પતિની માહિતી : ભોયરીંગણી, જે વિસ્તાર પ્રમાણે
 અલગ અલગ નામે ઓળખાય છે. ભોટંગડી, ભોરીંગણી
 કે ભોયરીંગણી વગેરે નામ હોય છે. આ વનસ્પતિ
 કાંટાળી હોય છે. તેનું ફળ ગોળ અને જાંબુ જેવં
 હોય છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : ભોયરીંગણીનાં બીજનો રોટલો
 ખાવાથી મગજની બીમારી મટી જાય છે.

(૫) ઊમાની છાલના રોટલા

પ્રેષક : વિનુભાઈ રૂપસિંગભાઈ ડિંડોર (વાવડી ફળિયું)

જરૂરી સામગ્રી : ઊમરો, મીઠું, પાણી

બનાવવાની રીત : નદીમાંથી ઊમરાની છાલ લાવી ખાંડીને
 જીણી કરો અને દળ્યા બાદ ચાળીને રોટલો બનાવો.

વનસ્પતિની માહિતી : ઉમરાના જાડનાં ફળ ગોળ હોય છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : સંપૂર્ણ પૌષ્ટિક શાક છે, કુદરતી પોષક તત્ત્વો પ્રાપ્ત થાય છે.

(૭) સામાના રોટલા

પ્રેષક : રેખાબહેન ગજાભાઈ હઠીલા (પટેલ ફળિયું)

જરૂરી સામગ્રી : ૫૦૦ ગ્રામ સામો, મીઠું, પાણી

બનાવવાની રીત : સામાના લોટને મસળીને રોટલો બનાવી તવીમાં શેકો અથવા તો સામાનાં પરોઠાં પણ બનાવી શકાય.

વનસ્પતિની માહિતી : સામાનો ઉપયોગ ફરાળી વાનગી તરીકે થાય છે. મુખ્યત્વે બહેનો સામા પાંચમનો ઉપવાસ કરે ત્યારે સામો ખાય છે. જેતરના શેઢા-પાળે થાય છે.

(૮) બાવટાનો રોટલા

પ્રેષક : સરલાબહેન બાબુભાઈ પટેલિયા (તળાવ ફળિયું)

જરૂરી સામગ્રી : ૫૦૦ ગ્રામ બાવટો, મીઠું, પાણી

બનાવવાની રીત : બાવટાના લોટ ચોળી રોટલો બનાવી તવીમાં શેકી નાખવું.

વનસ્પતિની માહિતી : બાવટો હલકા વર્ગનો ધાન્ય પાક છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : પૌષ્ટિક ખોરાક છે, પચવામાં હલકો છે.

(૮) ખાખરાની છાલના રોટલા

પ્રેષક : વિનોદભાઈ રૂપસિંગભાઈ ડિડોર (વાવડી ફળિયુ)

જરૂરી સામગ્રી : ખાખરાના થડની છાલ, મીઠું, પાણી

બનાવવાની રીત : ખાખરાના થડ ઉપરની છાલ લાવી ધોઈને સાફ કરી સુકવવી. સુકાઈ ગયા બાદ તેને ઘંટીમાં જીણા લોટની જેમ દળી નાખો. ત્યાર બાદ બાજરી, જુવાર કે મકાઈની જેમ રોટલા બનાવવાની પદ્ધતિથી રોટલો બનાવવો.

વનસ્પતિની માહિતી : ખાખરાનું ઝાડ થાય છે. તેનાં ફૂલ કેસરી રંગનાં હોય છે, જે ફિલુઆરી-માર્યમાં જોવા મળે છે.

સ્વાસ્થ્ય ઉપર અસર : શરીરમાં ઠંડક રહે છે.

સોયાબીનાનો ઇસોઈમાં ઉપયોગ

પ્રેષક : બદ્રીભાઈ સોમાભાઈ પટેલ. સોયાબીનને સાધારણ મીઠાના દ્રાવણમાં પલાળીને શેકી નાખવાથી (ખારી સીંગની જેમ) બાળકોને નાસ્તામાં આપી શકાય.

એક કિલો ઘઉંમાં માત્ર ૧૦૦ ગ્રામ સોયાબીન ભેળવીને દળવાથી લોટમાં મોણ ઓછું નાખવું પડે છે.

સોયાબીનને બરાબર પલાળીને બાફીને કઠોળની જેમ ઉપયોગમાં લેવાથી ગેસ નહીં થાય .

સોયાબીનને પલાળીને ગ્રાઇન્ડરમાં પીસીને જરૂર મુજબનું પાણી રેડી દૂધમાં સાકર, બદામ, એલચી નાખી પૌષ્ટિક દૂધમાં થોડી છાશ રેડીને સોયાબીનનું દહી પણ બનાવી શકાય.

કંદાગોળા/હવાઈ કંદ

ગુજરાતમાં આદિવાસી પ્રદેશમાં કંદાકોળુ/ચાંદાગોળું અથવા હવાઈ કંદના નામે આ ફળ ઓળખાય છે. આ વનસ્પતિની મુખ્ય વિશેષતા એ છે કે, તેના વેલા ઉપર હવામાં કંદ જોવા મળે છે અને જમીનમાં પણ બેસે છે.

બટાટાની જેમ ફળ ઉપર સુષુપ્ત અવસ્થામાં નાની આંખો હોય છે. જે રોપવાથી ચોમાસામાં ઉગ્ણી નીકળે છે. જમીનમાં રોપેલ આ ફળ દર વરસે મોટું થાય છે. જેમ જેમ તે મોટું થાય તેવી જ રીતે વેલા ઉપરના હવાઈ કંદનો વિકાસ વધતો જાય છે. જમીનમાં વિકસતું કંદ ત્રાશથી પાંચ વરસે મોટું સુરણ જેવું થાય છે. જેનું શાક બનાવવામાં આવે છે જ્યારે દર વરસે ચોમાસું મોસમના અંત ભાગમાં વેલા ઉપરથી હવાઈ કંદની ઉપજ થાય છે. ત્યારબાદ વેલો સુકાઈ જાય છે અને જમીનમાં રહેલ મૂળ કંદ સુષુપ્ત અવસ્થામાં આવી જાય છે, જે બીજા વરસે ચોમાસામાં આપમેળે ઉગ્ણી નીકળે છે.

વેલા ઉપરના હવાઈ કંદનું શાક બનાવવામાં આવે છે, જે બટાટાના વિકલ્પ તરીકે કામ કરે છે. ઉપરાંત ઉપવાસ હોય ત્યારે બાઝીને બટાટાની જેમ જ ખાઈ શકાય છે. હવાઈ કંદને સામાન્ય તાપમાને ઘરમાં કોઈ માવજત વિના આખું વરસ સંગ્રહી શકાય છે, જ્યારે અછિત કે દુષ્કાળ હોય ત્યારે આદિવાસી ભાઈઓ જમીનમાંથી કંદ કાઢીને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેઓ ઘરની આસપાસ વાડ ઉપર આ વેલા ઉગાડતા હોય છે. પદ્ધતિસરની જેતી હજુ કરવામાં આવતી નથી, પરંતુ એક નવા પાક તરીકે તેની ભરપૂર શક્યતાઓ દેખાઈ રહી છે.

સંકલન : મગનભાઈ ડામોર ગ્રામભારતી, અમરાપુર, તા. જી. ગાંધીનગર

ધાન્ય પાકોની પોષણ ક્ષમતા

અનાજ	પ્રોટીન (g)	કેટ (g)	કુદ ફાઈલર (g)	કાર્બોહાઇડ્રેટ (g)	એનર્જી (kcal)	કેલ્શીયમ (mg)	આયન (mg)	થાયેમીન (mg)	રાઈભ્રોફલેવીન (mg)	નીઅસેન (mg)
ડાંગર	9.6	2.7	9.0	99.0	392	33	9.6	0.89	0.004	4.3
ઘઉં	99.9	2.0	2.0	99.0	382	30	3.4	0.89	0.90	4.9
મકાઈ	6.2	4.9	2.6	93.0	346	29	2.9	0.36	0.20	3.9
જૂવાર	90.8	3.9	2.0	90.9	326	26	4.8	0.36	0.94	4.3
બાજરી	99.8	4.8	2.3	99.0	393	42	99.0	0.36	0.29	2.8
નાગલી/રાઠી/ બાવટો	9.9	9.4	3.9	92.9	339	340	3.6	0.82	.096	9.9
કાંગ	99.2	4.0	9.9	93.2	349	39	2.6	0.46	0.99	3.2
વરાઈ/ભગર	92.4	3.4	4.2	93.8	393	6	2.6	0.89	0.28	4.5
બંટી	99.0	3.6	93.9	94.0	300	22	98.9	0.33	0.90	4.2
કોદરા	6.6	3.9	4.2	99.9	343	34	9.9	0.94	0.06	2.0

(Source:- Hulse Laing and Pearson.1980: United states National Research Council/National Academy of Science 1982. USDA/HNIS.1984)